



The Baroda *Rayon* Corporation Ltd.

CIN L45100GJ1958PLC000892

P O Fatehnagar, Udhna, Surat 394 220

Tel : 0261-2899555

Email : admin@brcl.in

Website : www.brcl.in

May 30, 2026

To,
Department of Corporate Services,
BSE Limited
P. J. Towers, Dalal Street,
Mumbai – 400 001.

Sub – Newspaper Advertisement – Publication of Standalone Audited Financial Results of the company for the quarter and year ended March 31, 2026.

Ref – BSE Scrip code – 500270

Dear Sir,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, as amended, please find enclosed copies of newspapers advertisement [Financial Express (English) and Pratap Darpan (Gujarati)] edition which contains a Quick Response code and the details of the webpage where complete Standalone Audited Financial Results for the quarter and year ended March 31, 2026 along with the Audit Report are accessible to the investors.

Request you to kindly take the same on your record.

Thanking you,

Yours faithfully,

For The Baroda Rayon Corporation Limited

Kunjaj S Desai

**Kunjaj Desai
Company Secretary**

Encl: As Above



Vijay Commercial Co. Operative Bank Ltd.
"Vijay Bhavan", Kanak Road, Rajkot.

NOTICE OF SALE THROUGH PRIVATE TREATY
SALE OF IMMOVABLE ASSETS CHARGED TO THE BANK UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002, (SARFAESI ACT)

The undersigned as authorized officer of VIJAY COMMERCIAL CO-OPERATIVE BANK LIMITED, RAJKOT has taken over physical possession of the schedule property under the SARFAESI Act. The Authorized officer of VIJAY COMMERCIAL CO-OPERATIVE BANK LIMITED had already conducted multiple public auctions for settling the property, but they turned out to be unsuccessful as no bids were received. Hence please be informed that if the total outstanding dues in the aforesaid loan account are not paid within Seven (7) days from the date of this publication of this notice, then the Authorized officer will proceed for sale via private treaty of the property as stated below.

Public at large is informed that the secured property as mentioned in the schedule are available for sale through private treaty, as per the terms agreeable to the bank for realization of bank's dues on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS".

Standard terms & conditions for sale of property through private treaty are as under:

1. Sale through private treaty will be on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS".
2. The purchaser will be required to deposit 25% of the sale consideration on the next working day of receipt of bank's acceptance of offer for purchase of property and the remaining amount within 30 days thereafter.
3. The purchaser has to deposit 10% of Offer Amount along with the application which will be adjusted against 25% of the deposit to be made as per clause (2) above.
4. Failure to remit the amount as required under clause (2) above, will cause forfeiture of amount already paid including 10% Deposit amount paid along with application.
5. In case of non-acceptance of offer of the purchase by the bank, the amount of 10% Deposit paid along with the application will be refunded without any interest.
6. The purchaser should conduct due diligence on all aspects related to the property (under sale through private treaty) to his satisfaction. The purchaser shall not be entitled to make any claim against the authorized officer / Secured creditor in this regard at a later date.
7. The bank reserves the right to reject any offer of the purchase without assigning any reason.
8. In case of more than one offer, the bank will accept the highest offer.
9. The interested parties may contact the Authorized Officer for further details / clarifications for submitting their application.
10. The Purchaser has to bear all stamp duty, registration fee and other expenses, taxes, duties, society dues in respect of purchase of the said property.
11. Sale shall be in accordance with the provisions of SARFAESI Act / Rules.
12. The purchaser will have to pay any type of Govt. / Semi Govt. dues / Municipal Taxes / Electricity Bills / Gas Bills Etc. if any due on this property, if any document relating to this property is pending for payment of stamp duty the purchaser will have to pay the same.
13. In the court cases if any, relating to this property the order of the court would be binding to the purchaser.

Name of Borrower/Co-Borrower/ Mortgagee/Guarantor/Loan A/C No.	Amount as per 13(2) demand notice under SARFAESI Act.	Description of Secured assets / immovable property.	Base Price	Amount Of Deposit
Loan A/C No. 00102560200033 M/s. Sagar Impex (Borrower), Rakeshbhai Navaldas Dasani & Shilpaben Rakeshbhai Dasani (Partner), Madhusudan Chunilal Katharani (Guarantor),	Dt:08-05-2025 Rs. 1,73,65,656-00 Amount Rs. One Crore Seventy Three Lakhs Sixty Five Thousand Six Hundred Fifty Six Only.	Mortgaged Property Situated in Dist. Sub. Dist. Rajkot, Survey No. 374 Paiki, City Survey Ward No. 7, Sheet No. 323, City Survey No. 5046 Paiki, Plot No. 3, Sub Plot No. 3/C Land Area Adm. 73-47 Sq.Mtrs., Owned by Shilpaben Rakeshbhai Dasani and its bounded as per under North : Road Situated, South : Other Property Situated East : Other Property Situated, West : Road Situated, Physical Possession Date: 10-10-2025, Short Address : 6-Mavdi Plot, Near Ambika Way Bridge, Rajkot,	Rs. 56,20,000-00 (Fifty Six Lakhs Twenty Thousand Only)	Rs. 5,62,000-00 (Five Lakhs Sixty Two Thousand Only)

The aforesaid Borrower's / Co-Borrower's attention is invited to provisions of section 13(8) of SARFAESI Act for redemption of secured assets mentioned hereinabove by tendering the aforementioned outstanding dues together with all costs, charges and expenses incurred by the bank before the sale of secured assets.

Date fixed for inspection of the properties: Dt. 02-06-2026, Time: 11:00 A.M. to 4:00 P.M.
Last Date for submission of tender: 08-06-2026 (Up to 4.00 pm.)
Date, Time, & Place of Opening the Offers(Tenders): 09-06-2026, Time: 11:00 AM. Place:- Vijay Comm.Co.Op. Bank Ltd., "Vijay Bhavan", Kanak Road, B/H. Bus Stand, RAJKOT.
Correspondence Address: Mr. Durgesh V. Acharya : Authorised Officer VIJAY COMMERCIAL CO-OPERATIVE BANK LIMITED Address: "Vijay bhavan", Kanak Road, Behind S.T. Bust Station, Rajkot (Gujarat 001, Contact No. 9328941021.
Real estate brokers on behalf of participants are permitted, but bank will not pay any brokerage amount to such brokers.
Date : 30-05-2026
Place : Rajkot

Authorized Officer
VIJAY COMMERCIAL CO-OPERATIVE BANK LIMITED

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED
Narayan Chambers, 2nd Floor, B/H. Patang Hotel, Ashram Road, Ahmedabad-380009. Contact : 079-41106500 / 733

POSSESSION NOTICE
(FOR IMMOVABLE PROPERTY) Rule 8(1) of Security Interest (Enforcement Rules 2002)

Whereas the undersigned being the authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated as on below details calling upon the Borrower/Co-borrower/Guarantor to repay the amount mentioned in the notice being within Sixty Days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrower/Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said [Act] read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002, as on below details.

The Borrower/Co-borrower/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the Property will be subject to the charge of the MAS Rural Housing & Mortgage Finance Ltd. as on below details and interest thereon.

The Borrower/Co-borrower/Guarantor attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Borrower & Co-Borrower, Guarantor Name	Description Of The Immovable Property	Loan A/C No Date of Possession	Date & Amount of Demand Notice
1	SUBEDAR VIKRAMA NAVIK (APPLICANT) RITA (CO-APPLICANT)	PROPERTY BEARING ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING SHOP NO.F/2, ADMEASURING 21.84 SQ. MTRS. (BUILT UP AREA), ADMEASURING 35.97 SQ. MTRS. (SUPER BUILT UP AREA), ALONG WITH PROPORTIONATE UNDIVIDED SHARE IN GROUND LAND ADMEASURING 8.3937 SQ. MTRS. FIRST FLOOR AND CONSTRUCTION THEREON, IN SCHEME KNOWN AS "SHYAM PALACE" DEVELOPED UPON LAND SITUATED AT BEARING REVENUE SURVEY NO.194 & 195, BLOCK NO.121 DEVELOPED AS "PAREKH ESTATE" PAKKEE PLOT NO.3 PAKKEE PLOT NO. 3/A, 3/B, 3/C, 3/D, N.A LAND PAKKEE AT.MOJE: TATITHAIYA, TAL.PALSANA, IN THE REGISTRATION DISTRICT OF SURAT, STATE-GUJARAT. BOUNDED AS FOLLOWS: AS PER TECHNICAL : EAST : FLAT NO.101, WEST : PASSAGE, NORTH : SHOP NO.F/3, SOUTH : SHOP NO.F/1. BOUNDED AS FOLLOWS: AS PER SALE DEED / AS PER DOCUMENTS : EAST : FLAT NO.101, WEST : PASSAGE, NORTH : SHOP NO.F/3, SOUTH : SHOP NO.F/1.	Loan Account No : 10254 28-05-2026	Rs.6,44,889.00 in Words Six Lakhs Forty Four Thousand Eight Hundred Eighty Nine Rupees Only as on Date 10.03.2025.
2	KAUSHIKKUMAR SAUKHDEVBHAI RAVAL (APPLICANT) JYOTIBEN KAUSHIKKUMAR RAVAL (CO-APPLICANT) RIDHDHIBEN KAUSHIKKUMAR RAVAL (CO-APPLICANT) KUNTALKUMAR KAUSHIKKUMAR RAVAL (CO-APPLICANT) MANISHKUMAR ISHVARBHAI RAVAL(GUARANTOR)	PROPERTY BEARING ALL THAT PIECE AND PARCEL OF CITY SURVEY NO. 2020, BHILODA GRAM PANCHAYAT PROPERTY NO:10/184 (WESTERN SIDE) (AS PER SANAD KABULYAT PLOT NO.220) ADMEASURING 58.83 SQ. MTRS. & CONSTRUCTION THEREON SITUATED ON GAMTAL LAND, AT-BHILODA, TA-BHILODA, IN THE REGISTRATION DISTRICT & SUB DISTRICT OF ARAVALI, STATE-GUJARAT. BOUNDED AS FOLLOWS: AS PER TECHNICAL: EAST : PROPERTY NO. 10/184 (EASTERN SIDE) THEN NAVERI, WEST: 30 FT. ROAD, NORTH: ROAD THEN HOSPITAL, SOUTH: RESIDENT OF BHATIYA NARESHBHAI BOUNDED AS FOLLOWS: AS PER SALE DEED: EAST : PROPERTY NO.10/184 (EASTERN SIDE) THEN NAVERI WEST: 30 FT. ROAD NORTH : ROAD THEN HOSPITAL SOUTH: RESIDENT OF BHATIYANARESHBHAI	Loan Account No : 4173 28-05-2026	Rs.8,29,625.00 in Words Eight Lakhs Twenty Nine Thousand Six Hundred Twenty Five Rupees Only as on Date 27.03.2025.

Date : 30-05-2026
Place : Gujarat

Authorized Officer, Mr. Bharat J. Bhatt (M.) 9714199018
For, MAS Rural Housing & Mortgage Finance Ltd.

APPENDIX IV-A
Sale Notice for sale of Immovable Property
E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immovable Property mortgaged to India SME Asset Reconstruction Company Limited [CIN : U67190MH2008PLC181062] ("Secured Creditor"), the physical possession of which has been taken by the Authorized Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" (basis) on 06.06.2026 from 05.00 P.M. to 06.00 P.M., for recovery of Rs. 1,18,93,711/- (Rupees One Crore Eighteen Lakh Ninety Three Thousand Seven Hundred Eleven only) pending towards Loan Account No. HLPAAHE0291098, by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till 21.05.2026 with applicable future interest in terms of the Loan Agreement and other related loan documents) w. e. f. 22.05.2025 along with legal expenses and other charges due to the Secured Creditor from APURVA SURESH SETH (PROPRIETOR, MOTHER INSTITUTE OF ELECTRONIC TECHNOLOGY) and SONAL APURVA SETH.

The Loan Account bearing No. HLPAAHE0291098, along with all right(s), title(s), interest(s), underlying security(ies), pledge(s) and / or guarantee(s), including the Immovable Property, has been assigned by Sammaan Capital Limited ("SCL") (Formerly known as Indira Housing Finance Ltd.) to and in favour of the Secured Creditor acting as a Trustee of ISARC - 2025-2026-5 Trust vide Assignment Agreement dated 26.12.2025. The Secured Creditor has duly taken over the financial facility from SCL and is thus, vested with all powers and entitled to recover its outstanding dues in terms of the Loan Agreement and other related loan document(s) and / or enforcement of security interest in relation to the Immovable Property.

The Reserve Price for the Immovable Property will be Rs. 19,45,000/- (Rupees Nineteen Lakh Forty Five Thousand only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 1,94,500/- (Rupees One Lakh Ninety Four Thousand Five Hundred only), i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

PROPERTY SITUATED IN GUJARAT STATE AT REGISTRATION DISTRICT RAJKOT, SUB DISTRICT RAJKOT WITHIN THE LIMITS OF RAJKOT MUNICIPAL CORPORATION, ON CANAL ROAD, "SATYANARAYAN NIWAS" IN VIBHAG - C OF THE BUILDING KNOWN AS "GAYATRI", OFFICE NO. 302 HAVING BUILT - UP AREA OF 17-49 SQ. MTRS., GALLERY 3.7 SQ. MTRS., OFFICE NO. 303 HAVING BUILT - UP AREA OF 21-04 SQ. MTRS., GALLERY 9.2 SQ. MTRS., OFFICE NO. 304 HAVING BUILT - UP AREA OF 17-74 SQ. MTRS., GALLERY 3.67 SQ. MTRS., OFFICE NO. 305 HAVING BUILT - UP AREA OF 20.1 SQ. MTRS., GALLERY 3.53 SQ. MTRS. AND OFFICE NO. 306 HAVING BUILT - UP AREA OF 22-70 SQ. MTRS. THE OFFICE NOS. 302, 303, 304, 305 AND 306 ARE BOUNDED AS UNDER:

NORTH : OFFICE NO. 301 SOUTH : OFFICE NO. 303
EAST : ROAD WEST : COMMON PASSAGE

BOUNDARY OF OFFICE NO. 303 :
NORTH : OFFICE NO. 302 SOUTH : ROAD
EAST : ROAD WEST : OFFICE NO. 304

BOUNDARY OF OFFICE NO. 304 :
NORTH : COMMON PASSAGE SOUTH : ROAD
EAST : OFFICE NO. 303 WEST : OFFICE NO. 305

BOUNDARY OF OFFICE NO. 305 :
NORTH : OFFICE NO. 306 AND COMMON PASSAGE
SOUTH : ROAD

BOUNDARY OF OFFICE NO. 306 :
NORTH : OPEN TO SKY SOUTH : OFFICE NO. 305
EAST : COMMON PASSAGE WEST : OTHERS PROPERTY

For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.isarc.in; Helpline No : 0124-6910910, +91 7065451024; E - mail id : auctionhelpline@sammaancapital.com For bidding, log on to www.auctionfocus.in.

sd/-
AUTHORISED OFFICER
INDIA SME ASSET RECONSTRUCTION COMPANY LIMITED
Trustee of ISARC - 2025-2026-5 Trust
Date : 25.05.2026
Place : RAJKOT

RATNAKAR SECURITIES LIMITED (Formerly Known as Mangalya Soft-Tech Limited)
CIN - L66120G1992PLC017564
Regd. Office- Shop-304, "Sankalp Square-2", Nr. Delux Apartment, Nr. Kalgi Char Rasta, Jalarang Temple, Paldi, Ahmedabad-380006
E-mail: kushal@ratnakarsecurities.com, Contact no. 079-49005200

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2026

Sr. No.	Particulars	(Rs. in Crores Except EPS)		
		Quarter ended		Year ended on
		31-03-2026 Audited	31-03-2025 Audited	31-03-2026 Audited
1	Total Income From Operations (net)	4.51	4.44	18.05
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	0.33	0.37	1.98
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.33	0.37	1.98
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.56	(0.00)	1.92
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	0.37	0.04	1.76
6	Equity Share Capital, (face value of Rs. 10 each)	18.52	18.52	18.52
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year	-	-	-
8	Earning Per Share (of Rs.10 /- each) (For continuing and discontinued operations)			
	Basic	0.300	(0.080)	1.040
	Diluted	0.300	(0.080)	1.040

Note:

1. The above is an extract of the detailed Consolidated Audited financial results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.ratnakarsecurities.com)
2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 28, 2026.

For, Ratnakar Securities Limited
Sd/-
Kushal Ajay Shah
Whole Time Director
[DIN: 01843141]

Date: 29/05/2026
Place: Ahmedabad

RATNAKAR SECURITIES LIMITED (Formerly Known as Mangalya Soft-Tech Limited)
CIN - L66120G1992PLC017564
Regd. Office- Shop-304, "Sankalp Square-2", Nr. Delux Apartment, Nr. Kalgi Char Rasta, Jalarang Temple, Paldi, Ahmedabad-380006
E-mail: kushal@ratnakarsecurities.com, Contact no. 079-49005200

EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2026

Sr. No.	Particulars	(Rs. in Crores Except EPS)		
		Quarter ended		Year ended on
		31-03-2026 Audited	31-03-2025 Audited	31-03-2026 Audited
1	Total Income From Operations (net)	4.44	4.68	17.93
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	0.34	0.59	1.86
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	0.34	0.59	1.86
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.57	0.25	1.83
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	0.38	0.21	1.67
6	Equity Share Capital, (face value of Rs. 10 each)	18.52	18.52	18.52
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous year	-	-	-
8	Earning Per Share (of Rs.10 /- each) (For continuing and discontinued operations)			
	Basic	0.310	0.940	0.990
	Diluted	0.310	0.940	0.990

Note:

1. The above is an extract of the detailed Standalone Audited financial results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.ratnakarsecurities.com)
2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 28, 2026.

For, Ratnakar Securities Limited
Sd/-
Kushal Ajay Shah
Whole Time Director
[DIN: 01843141]

Date: 29/05/2026
Place: Ahmedabad

Possession Notice (For Immovable Property) Rule 8(1)

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IFL HFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, a Demand Notice was issued by the Authorized Officer of the company to the Borrower/Co-Borrowers mentioned herein below to repay the amount due to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Rules. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IFL HFL for an amount as mentioned herein under with interest thereon. The borrowers attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act. If the borrower dears the dues of the "IFL HFL" together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or transferred by "IFL HFL" and no further step shall be taken by "IFL HFL" for transfer or sale of the secured assets.

Name of the Borrower/Co-Borrower	Description of the Secured Asset / Immovable Property	Total Outstanding Dues (Rs.)	Date of Demand Notice	Date of Possession
Mr. Bhupatibhai Vajbhai Parmar Mr. Ranveersinh Bhupatibhai Parmar Mrs. Parmar Vinitabhai Bhubhatibhai Ranvir Bhai (Prospect No IL10241974)	All That Piece And Parcel Of Plot No. 651, Akher Vas, At-Kojan, Bayad, Ta-bayad, Sabarkantha, Gujarat, India, 383326 Area Admeasuring (In Sq. Ft.) Property Type: Area, admeasuring Property Area: 1350	Rs.441626/-Rupees Four Lakh Forty One Thousand Six Hundred Twenty Six Only	09-03-2026	26-05-2026
Mr. Babuji Haraj Chauhani Mrs. Divaben Babuji Chauhani (Prospect No IL10343668)	All That Piece And Parcel Of Mikhat No. 117, Area Measuring 1500 Sq Ft., Situated At Village Gadhi Muddi, Danta, Banaskantha, Gujarat 385120 Area Admeasuring (In Sq. Ft.) Property Type: Area, admeasuring Property Area: 1500	Rs.394999/-Rupees Three Lakh Ninety Four Thousand Nine Hundred Ninety Nine Only	05-01-2026	25-05-2026
Mr. Jyotnarain Dabhi Mrs. Jyotnarain Dabhi Mrs. Bhuraji Milk Income (Prospect No IL10795328)	All That Piece And Parcel Of House No 1090, Dabhi Vas, Chekhia, Chokhala, Near By Brahmani Temple, Banas Kantha, Gujarat, India, 385550 Area Admeasuring (In Sq. Ft.) Property Type: Area, admeasuring Property Area: 2250	Rs.278801/-Rupees Two Lakh Eighty Eight Thousand Eight Hundred One Only	09-03-2026	26-05-2026
Mr. Bhavanj Somaji Dabhi Mrs. Sangitaben Bhavanj Dabhi Milk (Prospect No IL10806152)	All That Piece And Parcel Of House No 646, At Verabar, Patel Fali, Verabar, Nera Hanumaji Temple, Indar, Gujarat, India, 383434 Area Admeasuring (In Sq. Ft.) Property Type: Area, admeasuring Property Area: 1100	Rs.448509/-Rupees Four Lakh Forty Eight Thousand Five Hundred Fifty Nine Only	09-03-2026	26-05-2026
Mr. Makwana Anurabhai Shivabhai Mr. Makwana Shivabhai Prabhakar Mrs. Vaishaliben Anurabhai Makwana Anurabhai Auto Driver (Prospect No IL10809220)	All That Piece And Parcel Of Mikhat No. 476, House No 474, Area Admeasuring 2100 Sq Ft, Village Nathpura, Taluka Kanika, District Banaskantha, Gujarat 385550 Area Admeasuring (In Sq. Ft.) Property Type: Land, area, Built_up_area Property Area: 2100.00, 830.00	Rs.281346.94/-Rupees Two Lakh Eighty One Thousand Three Hundred Forty Six & Ninety Four paise only	10-02-2026	25-05-2026
Mr. Parmar Pralhadbhai Khodabhai Mrs. Parmar Geetaben Pralhadbhai Milk Business Pralhadbhai (Prospect No IL10900327)	All That Piece And Parcel Of 451, Undani Muvadi, Singhalji, Primary School, Kheda, Gujarat, India, 387430 Area Admeasuring (In Sq. Ft.) Property Type: Land, area, Built_up_area Property Area: 540.00, 530.00	Rs.367619/-Rupees Three Lakh Sixty Seven Thousand Six Hundred Nineteen Only	09-01-2026	25-05-2026
Mr. Zala Chandubhai Motibhai Mrs. Zala Keshaben Chandrasani Milk Business Chandubhai (Prospect No IL10943821)	All That Piece And Parcel Of Mikhat No. 501, Admeasuring Of 448 Sq. Ft., Kundolaha Muvadi, Kapadvanj, Kheda, Gujarat 387620 Area Admeasuring (In Sq. Ft.) Property Type: Land, area, Built_up_area Property Area: 448.00, 447.00	Rs.289823/-Rupees Two Lakh Eighty Nine Thousand Eight Hundred Twenty Three Only	10-02-2026	25-05-2026

For further details please contact to Authorized Officer at Branch Office : Ahmedabad Commerce House, 4th Floor, Commerce House, 4, N. Small Petrol Pump, Anandnagar Road, Pratiknagar, Ahmedabad - 380011, Shop No E/304, First Floor, Golden Trade Centre, Old National Highway-9 Road, Arkeshpur-383002, Dist. Bhavnagar Office No.701, 7th Floor, 21st Century Business Center, Near Udhna Darwaja, Ring Road, Surat - 395002 or Corporate Office : IFL Tower, Plot No. 58, Udyog Vihar, Ph-IV Gurgaon, Haryana, India.

Place : Gujarat, Date : 30.05.2026
Sd/- Authorized Officer, For IFL Home Finance Ltd.

THE BARODA RAYON CORPORATION LIMITED
CIN - L45100GJ1958PLC000892
Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220
(T) 0261-2899555 | Email-admin@brcl.in | website-www.brcl.in

Standalone Audited Financial Results for the Quarter & Year ended March 31, 2026

The Board of Directors of the company, at their Meeting held on May 29, 2026 approved the Audited Financial Results of the company for the quarter and year ended March 31, 2026.

The results, along with Auditors Report are also available on the Company's webpage at <http://brcl.in/Uploaded File/Corporate Announcement/29052026151101634.pdf> and website of the stock exchange i.e. BSE Limited at www.bseindia.com and can also be accessed by scanning the QR Code.



For The Baroda Rayon Corporation Limited
Sd/-
Damodarbai Patel
Managing Director
DIN-00056513

Date : 29-05-2026
Place : Surat.

Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (LODR) Regulations, 2015.

GANESH HOUSING LIMITED
(Formerly known as Ganesh Housing Corporation Limited)
CIN: L45200G1991PLC015817
Regd. Office: Ganesh Corporate House, 100 Feet Hebatpur- Thaltej Road, Nr. Sola Bridge, Off. S.G. Highway, Ahmedabad - 380 054
(P) : +91 79 6160 8888 (W) : www.ganeshhousing.com (E) : secretarial@ganeshhousing.com

STATEMENT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31/03/2026

PART - I

PARTICULARS	(RS. IN LAKHS)				
	3 months ended		Preceding 3 months ended in the Previous year		Corresponding 3 months ended in the Previous year
	31-03-2026 Audited	31-12-2025 Unaudited	31-03-2025 Audited	31-03-2025 Unaudited	31-03-2026 Audited
1. Total Income from Operations	9,506.07	9,029.55	25,108.95	51,374.42	95,976.18
2. Net Profit/(Loss) for the period (before Tax and Exceptional Items)	9,570.21	7,263.19	22,149.31	43,976.61	80,773.55
3. Net Profit/(Loss) for the period (before Tax, after Exceptional Items)	9,570.21	7,263.19	22,149.31	43,976.61	80,773.55
4. Net Profit/(Loss) for the period (after Tax, after Exceptional Items)	6,136.20	5,374.20	16,490.02	31,625.81	59,806.00
5. Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax))	6,136.20	5,374.20	16,490.02	31,625.81	59,806.00
6. Equity Share Capital (Paid-up)	8,338.71	8,338.71	8,338.71	8,338.71	8,338.71
7. Other Equity (Excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	-	-	-	-	224,777.14
8. Earnings per share (of Rs.10 each) (For continuing and discontinued operations)					
(a) Basic	7.36	6.44	19.78	37.93	71.72
(b) Diluted	7.36	6.44	19.78	37.93	71.72

Note:

- (1) The above is an extract of the detailed format of Quarterly and Yearly Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com. The same are also available on the Company's website viz. www.ganeshhousing.com.
- (2) Additional Information of Standalone Audited financial results is as under:

PARTICULARS	(Rs. In Lakhs)				
	3 months ended		Preceding 3 months ended in the Previous year		Corresponding 3 months ended in the Previous year
	31-03-2026 Audited	31-12-2025 Unaudited	31-03-2025 Audited	31-03-2025 Unaudited	31-03-2026 Audited
Revenue from Operations	1,226.93	4.06	3,880.62	12,533.87	6,729.26
Profit/(Loss) before Tax	163.11	1,038.80	1,849.51	5,293.76	5,095.32
Profit/(Loss) after Tax	(847.43)	(942.74)	1,051.94	3,571.44	3,804.90

Date: 29/05/2026
Place: Ahmedabad

For Ganesh Housing Limited
(Formerly known as Ganesh Housing Corporation Limited)
Sd/-
Shekhar G. Patel
Managing Director & CEO
[DIN: 00005091]

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 આઈટીઆઈનો કાર્યાલય કરાશે



ભુજ, ૨૯ મે ૨૦૨૬: અદાણી શુપના કેપેબિલિટી-બિલ્ડિંગ પ્લેટફોર્મ 'અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન' (ASE) એ કચ્છ જિલ્લાની ૧૧ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ના કાર્યાલય માટે ગુજરાત સરકાર સાથે બે મહત્વપૂર્ણ એમઓયુ (MoUs) કર્યાં છે. આ ભાગીદારી હેઠળ ઉદ્યોગોને જરૂરી સ્કીલિંગ અને રોજગાર-લક્ષી તાલીમ પૂરી પાડવામાં આવશે.

કચ્છ જિલ્લો અત્યારે રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યો છે. આ પહેલનો હેતુ સ્થાનિક યુવાનોને પ્રદેશના આગામી વિકાસમાં ભાગીદાર બનવા માટે જરૂરી કૌશલ્યો અને એક્સપોઝર આપવાનો છે.

ભુજની ગેઈમ્સ (GAIMS) ઓડિટોરિયમ ખાતે યોજાયેલા 'કર્મ ઉલ્સવ' કાર્યક્રમ દરમિયાન આ એમઓયુ કરવામાં આવ્યા હતા. આ સહયોગ ટેકનિકલ શિક્ષણને રોજગારની જરૂરિયાતો સાથે જોડવા અભ્યાસક્રમની ગુણવત્તા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ, ફેકલ્ટી ડેવલપમેન્ટ, પ્રેક્ટિકલ એક્સપોઝર અને પ્લેસમેન્ટ સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે રાજ્યના ગ્રામ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી

કુંવરજીભાઈ બાવળિયા, ગ્રામ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકેતભાઈ ઇંગા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કચ્છ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત સરકારના અધિકારીઓ તેમજ અદાણી શુપના વરિષ્ઠ પદાધિકારીઓ અને કચ્છની તમામ ૧૧ સરકારી ITI ના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. ASE દ્વારા વિદ્યાર્થીઓને 'સ્કીલટુએમ્પ્લોય' (Skill2Employ) આમંત્રણ પત્રો એનાયત કરાયા હતા. ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ૨૨ વિદ્યાર્થીઓને 'સર્ટિફિકેટ ઓફ એક્સલેન્સ' અને ASE ના ટ્રેન-અ-ટ્રેનર (TTT) પ્રોગ્રામ હેઠળ ૩૦ ઈન્સ્ટ્રુક્ટર્સને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અદાણી ઈકોસિસ્ટમમાં કાર્યરત સ્નાતકોએ પણ તેમની સફળતાની સફર શેર કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈએ આત્મનિર્ભર કાર્યબળના નિર્માણમાં ઉદ્યોગ-અનુકૂળ કૌશલ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, "અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને વૈશ્વિક સ્તરની ટેકનિકલ તાલીમ આપવાનો અને સ્કીલ ઈન્ડિયા મિશન હેઠળ દરેક યુવાન સ્વનિર્ભર બને તે સુનિશ્ચિત કરવાનો છે." રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણની તકોનો

લાભ ઉઠાવી સાર્થક કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, "કુશળ યુવાનો આખા દેશની સાચી તાકાત છે અને તેઓ ભારતના આર્થિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મોટું યોગદાન આપી શકે છે." અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) ના ચીફ ઓફિસર ટુલિવ ઓફિસર (CEO) રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે, "કચ્છ એ અમારી કર્મભૂમિ છે અને અમે તેના ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. ગુજરાત સરકાર અને સ્થાનિક સાથેની ભાગીદારી દ્વારા અમારો હેતુ એક એવું સક્ષમ અને કુશળ વર્કફોર્સ તૈયાર કરવાનો છે જે લાંબા ગાળાના પ્રાદેશિક પરિવર્તનમાં મદદરૂપ બને." 'સ્કીલટુએમ્પ્લોય' અભિગમ દ્વારા ASE ક્લાસરૂમ લર્નિંગને વાસ્તવિક ઓપરેટિંગ એક્સપોઝર સાથે જોડે છે. સિમ્યુલેશન, સેન્ટર્સ ઓફ એક્સલેન્સ (CoEs) અને વૈશ્વિક સ્તરના અભ્યાસક્રમની મદદથી તે પ્રથમ દિવસથી જ પ્રોડક્ટિવ વર્કફોર્સ તૈયાર કરવા માંગે છે. આ પહેલથી જ પ્રતિભાઓનું પલ્કાપન અટકશે અને કચ્છનો વિકાસ સ્થાનિક પ્રતિભાઓ દ્વારા જ થશે. ASE દ્વારા ITIs ના પરિવર્તન માટે કલ્પના કરાયેલ ૧૦-મુદ્દાના એજન્ડાને હવે દેશના અન્ય રાજ્યોમાં "ગુજરાત મોડેલ" તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

ચેક રિટર્નના ચાર બુદા બુદા કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા

ચેક રિટર્નની પુરેપુરી રકમ ચૂકવી દેવા કોર્ટનો આદેશ

પ્રતાપ પ્રતિનિધિ, સુરત, તા. ૩૦
ટેક્સટાઈલ ક્ષેત્રે એક કાપડની ખરીદી બાદ પેમેન્ટ પેટે આપેલા ચેક રિટર્ન થવાના ચાર અલગ-અલગ કેસોમાં પલસાણા કોર્ટે આરોપી મહિલા વેપારીને દોષિત ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

કેસની વિગત મુજબ, 'શ્રી શ્યામ કિએશન'ના પ્રોપાઈટર રૂપલ અંકિત અગ્રવાલે 'ટેક્સપિન ટેક્સટાઈલ' પેઢીના ભાગીદાર અજયભાઈ મંગનલાલ નરોડીયા પાસેથી રૂ. ૪૫,૪૫૬/- નું શ્રે-કાપડ ખરીદ્યું હતું. જેના પાટ પેમેન્ટ પેટે આરોપીને રૂ. ૬૮,૮૨,૧૬૩/- ના કુલ ૪ ચેકો સહી કરીને આપ્યા હતા. આ ચેકો બેંકમાં જમા કરાવતા જ રિટર્ન થયા હતા. લીગલ નોટિસનો જવાબ ન

મળતા, ફરિયાદીએ એડવોકેટ રમેશ ભી. સાનેપરા મારફતે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ પલસાણા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાર ઠેરવી ૧ વર્ષની કેદ અને ચેકની પૂરેપૂરી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આ રકમ ન ચૂકવાય, તો વધુ ૬ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.

ખંડણી કેસમાં પ્રવીણ ભાલાળાની આગોતરા જામીન અરજી નામંજૂર

પ્રતાપ પ્રતિનિધિ, સુરત, તા. ૩૦
ખંડણી અને ગુનાહિત કાવતરાના ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રવિણ ભાલાળાની આગોતરા જામીન અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલાએ લોન આપવાના બહાને ફરિયાદી યુવકનો સંપર્ક કર્યો હતો અને તેને રોમેન્ટિક તેમજ સેમી-ન્યુડ વીડીયો-ફોટો મોકલ્યા હતા. ત્યારબાદ હોટલમાં ફરિયાદીને મળવા બોલાવી, આરોપીઓએ તેને બળાત્કરના પોટા કેસમાં ફસાવવાની અને સામાજિક બદનામી કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ફરિયાદી પાસેથી રૂ. ૧૪,૦૦,૦૦/- (ચૌદ લાખ) પડાવી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં આરોપી પ્રવિણ વિહલ ભાલાળાની પણ સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા. જેથી પ્રવીણે આગોતરા જામીન અરજી કરી હતી. બંને પક્ષની દલીલો ધ્યાને લઈ કોર્ટેનો સ્પષ્ટ મત છે કે આરોપીની કસ્ટડીમાં પૂછપરછ અત્યંત જરૂરી છે. ગુનો કરવામાં આરોપી દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિનો ખુલાસો કરવો જરૂરી છે. કાયદાનું રક્ષણ કાયદાનું પાલન કરનારાઓ માટે છે, કાયદાથી ભાગતા લોકો માટે નહીં. કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

ઈક્વિએન્ટ ટ્રીટમેન્ટ અને વોટર રિસાઈક્લિંગ સિસ્ટમનું અવલોકન કર્યું અને પર્યાવરણ સંરક્ષણ, પાણી બચત અને સર્ક્યુલર ઈકોનોમી માટે ઉદ્યોગો દ્વારા કરવામાં આવતા સામૂહિક પ્રયત્નોની પ્રશંસા કરી. આ મુલાકાત સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની સરતેનેબલ ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ, સ્કિલ ડેવલપમેન્ટ, પર્યાવરણ અનુરૂપ ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાપ્રતિની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને મજબૂત બનાવે છે.

દીવા રોડ પર
પેજ-૨ પાનાનું ચાલુ
આગામી ચોમાસામાં અહીં અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાશે અને લોકોના વિસ્તારમાં ગંદા પાણી ભરાશે. "વધુમાં આ ગંભીર પરિસ્થિતિને જોતા હવે સ્થાનિકોની માંગ છે કે દાંડી માર્ગ વિભાગના ટેકનિકલ અધિકારીઓએ પોતે તાત્કાલિક સ્થળ મુલાકાત (વિઝીટ) કરવી જોઈએ અને ચોમાસાની પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ."

કામ કરી રહેલી કોન્ટ્રાક્ટર એજન્સીને મોટી સાર્વજનિક પાઈપ મૂકવા અથવા વૈકલ્પિક મજબૂત વ્યવસ્થા કરવા માટે કડક દિશા-નિર્દેશ આપવા જરૂરી છે. આ ઉપરાંત, અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા પંચાયતના અધિકારીઓએ પણ આપત્તિ વ્યવસ્થાપનાના ભાગરૂપે સંયુક્ત વિઝીટ કરીને આ બાબતે યોગ્ય વહીવટી પગલાં લેવા જોઈએ. જો તંત્ર હજી પણ ઊંઘતું રહેશે, તો આ ચોમાસે અનેક વિસ્તારના રહીશોએ ભયના આધાર હેઠળ જીવવાનો વારો આવશે તે નક્કી છે. વધુમાં જો આ નાળાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આ રોડ પર આવેલ શાળાઓના વિદ્યાર્થી, વાલી અને ગ્રામ પ્રજાએ કપરી સ્થિતિનો સામનો

ઉલ્લા પાનાનું ચાલુ
વસતિ ગણતરીમાં
મહિલાઓ, નાના અને સ્તનપાન કરાવતા બાળકોની માતાઓ તેમજ જેમના પર વયોવૃદ્ધ માતા-પિતા કે સાસુ-સસરાની સંપૂર્ણ સંભાળ રાખવાની જવાબદારી હોય તેવી મહિલા શિક્ષકો આ વસ્તી ગણતરીની કપરી કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. ગંભીર બીમારીઓથી પીડાતા, શારીરિક રીતે અશક્ત હોય તેવા મોટી

નવી સિવિલના તબીબોએ ૪૮ વર્ષીય મહિલા દર્દીની 'બોઆરી ફ્લેપ'ની સફળ સર્જરી કરી

ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૩ લાખ સુધીની સારવાર નવી સિવિલ ખાતે નિ:શુલ્ક થઈ

સુરત, તા.૩૦
સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સફળ જટિલ સર્જરી કરી મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂ. ૨ થી ૩ લાખના ખર્ચે થતી આ સર્જરી નવી સિવિલ ખાતે નિ:શુલ્ક મેળવતા દર્દી અને પરિવારને મોટી આર્થિક રાહત થઈ છે.

સુરતના ડીડોલીમાં રહેતા ૪૮ વર્ષીય સીમા સિંગને સ્ત્રી રોગની સારવારના ભાગરૂપે ગર્ભાશય દૂર કરવાની કોમ્પ્લેક્સ શસ્ત્રક્રિયા દરમિયાન પેશાબની નળીને ઈજા પહોંચતા નવી સિવિલના તબીબોએ 'બોઆરી ફ્લેપ' (Boari Flap) નામની અત્યંત આધુનિક સર્જરી કરીને દર્દીને નવજીવન આપ્યું હતું.

જેમાં પેશાબની થેલીના જ એક ભાગમાંથી નવો રસ્તો બનાવીને કિડનીમાંથી આવતા પેશાબનો પ્રવાહ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. નવી સિવિલના ડ.તબીબી અધિક્ષક ડો.પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના વડા ડો.નિમેશ વર્મા, યુનિટ હેડ અને સહાયક પ્રાધ્યાપક ડો.સંદીપ કંસલ અને મદદનીશ પ્રાધ્યાપક ડો. તેજસ પટેલ તેમજ સિનિયર રેસિડન્ટ ડો.ગૌતમ ભારડા અને ડો.શ્યામ પ્રાંચુ તેમજ જુનિયર રેસિ. ડો.વિભોર ગુપ્તા દ્વારા મહિલા દર્દીની સારવારના ભાગરૂપે 'બોઆરી ફ્લેપ' એટેલે કે પેશાબની થેલીના ઉપરના ભાગમાંથી માંસપેશીનો એક નાનો ટુકડો (ફ્લેપ) પટ્ટીની જેમ કાપી, તેને વાળી એક નળી

જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો

'જિલ્લા સ્વાગત' કાર્યક્રમમાં પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિત કુલ ૧૪ પ્રશ્નો પૈકી ૧૨ પ્રશ્નોનું નિરાકરણ કરાયું

સુરત, તા.૩૦
નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ 'સ્વાગત' અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એપ્રિલ મહિનાના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષાએ નિરાકરણ ન આપ્યા હોય તેવા ૧૪ જેટલા પ્રશ્નોને જિલ્લા કલેક્ટરશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિતના કુલ ૧૨ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિવારણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ગેરકાયદેસર બાંધકામ, પાકિંગ દબાણ, સિંચાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, પ્રોપર્ટી કાર્ડ, વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન, RTE હેઠળ એડમિશન તેમજ NOC ન આપવા બાબત સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં અરજદારોના

પ્રશ્નોનો સંતોષજનક નિકાલ કરવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવ્યા વિના, નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે સૂચનાઓ કર્યાં હતા. સ્વાગત કાર્યક્રમ એ પ્રજાના અવાજને સાંભળવાનું અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનું સશક્ત માધ્યમ છે. સરકારી નિણંદોનું યુસ્ત પાલન થાય અને અરજદારોને ન્યાય મળે તે તમામ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે એમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીશ્રા (IAS), જિ.પોલીસ વડા રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, જ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકા, જિ.પુરવઠા વિભાગ, સિટી સર્વે, શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્રના અધિકારીઓ સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઉંમરના શિક્ષકો તેમજ જેઓની નોકરી નિવૃત્તિના આરંભ ૧ વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તેવા વરિષ્ઠ શિક્ષકોને પણ આ ફરજમાંથી મુક્ત રાખવા વિનંતી કરાઈ છે. તંત્રની અસ્પષ્ટ ફાળવણી અને ઈલેવી ધીની અવ્યવસ્થા પર સવાલ ઉઠાવતા મહાસંધે જણાવ્યું છે કે કામગીરી શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે છતાં હજી સુધી કેટલાક શિક્ષકોને ઓર્ડર કે વિસ્તારની ફાળવણી કરવામાં આવી નથી, જેનાથી શિક્ષકોમાં અસમંજસની સ્થિતિ છે, તેથી બાકી રહેલા તમામ શિક્ષકોને ઓર્ડર આપતી વખતે જ ઘર કે શાળાની નજીકના વિસ્તારો જ ફાળવવામાં આવે.

મહાસંધે વધુમાં માંગણી કરી છે કે કામગીરીના ભારણને સંતુલિત કરવા માટે 'એક શિક્ષક - એક જ બ્લોક' નો નિયમ લાગુ કરવામાં આવે અને જે શિક્ષકોને એક કરતાં વધુ બ્લોકની કામગીરી સોંપાઈ છે, તેઓ ના વધારાના બ્લોકની કામગીરી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. વળી, જે શિક્ષકો હાલમાં બી.એલ.ઓ. (Booth Level Officer) તરીકેની સહન સ્તરીય કામગીરી કરી રહ્યા છે, તેઓને બે વડા કામના ભારણમાંથી બચાવવા માટે વસ્તી ગણતરીની આ કામગીરીમાંથી મુક્તિ આપવી જોઈએ. શાળામાં બાળકોના શૈક્ષણિક કાર્યની જાળવણી પણ એટલી જ મહત્વની હોવાથી મહાસંધે ૫૦ ટકા સ્ટાફનો નિયમ લાગુ કરવા જણાવ્યું છે, જેથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ બાળકોનું શિક્ષણ કાર્ય કોઈ પણ અવરોધ વિના ચાલુ રહી શકે અને બાકીનો સ્ટાફ શાળામાં જ રહીને શિક્ષણ કાર્ય સંભાળે. આ સમયગાળા દરમિયાન શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રવેશ પ્રક્રિયા, સી.ટી.એસ. અરેશન, યુ-ગ્રાઉસ પ્લસ ડેટા એન્ટ્રી, ડિજિટલ ગુજરાત પોર્ટલની કામગીરી, ૩૧ જુલાઈનું સેટઅપ સંબંધિત કામગીરી તેમજ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ અને ચૂલ જેવી શૈક્ષણિક સહાયના વિતરણ જેવી અગત્યની વહીવટી અને શૈક્ષણિક કામગીરીઓ પણ સમયમર્યાદામાં કરવાની હોવાથી, તંત્ર દ્વારા શાળાઓ અને શિક્ષકોના હિતમાં સત્વરે સકારાત્મક નિણંદો

લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

મનપાની કચરા

ગયા હતા. અકસ્માત બાદ કચરાની ગાડીમાંથી રોડ પર પડેલા વચ્ચેથી પેટાતા જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. રાત્રિના અંધારામાં પાલિકાના સત્તાવાર વાહનમાં આ પ્રકારે માંસના લોચા જોઈને સ્થાનિક નાગરિકોમાં ભારે આકોશ ફાટી નીડળ્યો હતો. જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોમાં ચર્ચા શરૂ થઈ રહી હતી કે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરો ઉપાડતા ટેમ્પોમાં આટલો મોટો માંસનો જથ્થો અને તે પણ શંકાસ્પદ ગોમોંસ કચાથી આવ્યું? આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને તુરંત જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એસ.બી. દેસાઈે સહિતના પોલીસ કાર્કલો સહાયક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસે તુરંત જ મોરચો સંભાળી લીધો હતો. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસે પુરાવાઓ સાથે કોઈ છંડછાડ ન થાય તે માટે

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ રાત્રે જ સ્થળ પર બોલાવી લીધી હતી. FSLની ટીમે રોડ પરથી અને ટેમ્પોમાંથી શંકાસ્પદ માંસના સેમ્પલ લઈને તેને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે,

ટ્રાફિક પોલીસ

શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ અને પોઈન્ટ પર રીક્ષાચાલકો મનસ્વી રીતે રસ્તા પર દબાણ કરી પેસેન્જર લેવા માટે ઊભા રહી જતા હોય છે. તેના કારણે અન્ય વાહનચાલકોને નાના-મોટા અકસ્માતનો ભય રહે છે. આવા દબાણને દૂર કરવા માટે જ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી

પલસાણામાં
વિસ્તારમાં આવેલી કેરીની વાડીઓ ભાડે રાખી હતી. વાડીમાં તૈયાર થયેલા કેરીના પાકનું વેચાણ કરવાની ટેન્ડરની ચાલી રહી હતી. આ દરમિયાન ૮ મે ૨૦૨૬થી ૧૮ મે ૨૦૨૬ વચ્ચે કોઈપણ સમયે આરોપી યોગેશભાઈ મેથાઈલાલ બનવાસી અને ભાઈ રમેશભાઈ બનવાસી સહિત અન્ય અજાણ્યા શખ્સોએ મળીને વાડીમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ વાડીમાંથી આશરે ૧૨૦ મણ કેરીની ચોરી કરી હતી. ચોરાયેલી કેરીની કિંમત અંદાજે રૂ. ૬૦,૦૦૦ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

THE BARODA RAYON CORPORATION LIMITED
Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220 (T) 0261-2899555 Email-admin@brcl.in CIN - L45100GJ1958PLC000892 website-www.brcl.in.

માર્ચ ૩૧, ૨૦૨૬ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક સમયગાળા માટેના ઓડિટડ અકલ નાણાકીય પરીણામોનો અહેવાલ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મે ૨૯, ૨૦૨૬ના રોજ યોજાયેલી તેમની મીટિંગમાં માર્ચ ૩૧, ૨૦૨૬ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર તેમજ વાર્ષિક સમયગાળા માટે કંપનીના ઓડિટડ અકલ નાણાકીય પરીણામોનો અહેવાલ દર્શાવેલ છે. આ પરીણામોનું સંપૂર્ણ બંધારણ કંપનીની વેબસાઇટ <http://brcl.in/UploadedFile/CroproateAnnouncement/૨૮૦૫૨૦૨૬૧૫૧૦૧૯૩૮.pdf> અને બીએસઈ સ્ટોક એન્ડેક્સની વેબસાઇટ www.bseindia.com પર ઉપલબ્ધ છે અને ક્યુઆર કોડ સ્કેન કરીને એક્સેસ કરી શકાય છે.

તારિખ: ૨૯/૦૫/૨૦૨૬
કોર થી બરોડા રયોન કોર્પોરેશન લિમિટેડ
સ્થળ: સુરત સહી/

દામોદરભાઈ પટેલ
મેનેજિંગ ડાઈરેક્ટર
ડી-૦૦૦૫૬૧૧૩